

## ‘हुशिंह लज्जयुक्ती शतसंगे’ वैष्णववाची

“[द्वितीन कुमुखाकर वा. २ पाठ न. २ द्वितीन वा. ४]

भद्रा सुद्धि पाचमधी वसात्-ऐलो मार-ब  
थाय राज्ञेऽगानां इर्षानमां क्षी....ने अ-हन, विवा,  
गुलाल, अणीरना, सूक्ष्म घोल थाय, भद्रा सुद्धि  
पौर्णी उपसूधी हस्तिवस ऐल समये श्रीगुरुसाहित्य  
कृत नाथेन अष्टपदी ‘वसात्’ रागमां गवाय छे.

“श्रीगुरुसाहित्य, ‘सूर्यारक्षम-डन’ अथवा  
सूर्यना, डनी छे, आय अथेना, ग्रन्थ, प्रकारण छे.  
(१) उत्तरासर्वस्व, कुमारिका गोपीजनोना  
कात्यायना तत अने शीरहरण्यनु आमां निरुपण छे.  
(२) दानलीला, श्रीयद्रावलीला आहि शुतिरुपा  
गोपीजनो पासेथी, दानना, भिषे करेल, प्रभुना  
लीला-विलासनु आमां निरुपण छे. (३) उद्दास  
प्रकृतपूर्णमां दश उद्दास छे, तेमां श्रीराधिकालना  
विमयोग अने प्रभु आथेना संप्रीण-विलासनु  
निरुपण छे.

आहा दश ‘उद्दास’ पैठीना, प्रथम ‘उद्दास’मा  
आष्टपदीनी रचना छे.

प्रसंग, आ प्रभावे छे; अष्ट विस ए प्रज-  
रन्ता बळंगनाच्यो श्रीयमुनालुना पुढिन परनी  
कोळ निकुञ्जमां लोगां थई गयां, अने सभीच्या  
प्रतीनीं प्राण-प्रियतमनी रसबाबी लीलाच्यानु  
हुशिंह-द्वितीन कृत्या लाग्या.

इति कृत्या कृत्या पूछे छे; खडक । आपांच्या त्वामिनी  
श्रीराधिकाल्लु त्रियतम श्रीहुशु साथे प्रथम भिलास  
क्षम्युं ते प्रसंग, मने कडे.

पीलु/सभीच्ये भेनमां श्रीस्वामिनील्लु अति  
अभीर्भी भंगते हमरणु क्षुर्यु, स्मरण्य थता तेना  
अंग-अंग रोमांचित थयां, विशाळ, नेत्रोमां  
अनु उक्षरायां, लीला-रस-सागर हेयेथी छलकार्य  
होठेथी वडेवा लाग्यो.

तेषु क्षुर्युः सणी । सौ प्रथम कृत्या विस  
श्रीराधिकाल सौणीच्यो साथे खरसानाथी वृंदावन  
पद्मार्थी हुतां, वृंदावनमां श्रीयमुना-तट, मुख गति  
रणियामहु वातावरणु हुतु, लां तेमणे श्रीराध-  
मुहुरने अनेक बळंगनाच्योनां वृंदाथी दीर्घायेला  
निहाण्या.

श्रीयुगल त्वद्वप्याचे परस्परने नीरभां, चार  
नेत्रा एक थयां, नेत्रोमांधी प्रेमने, धौध अगरये,  
दोम-दोम अडां थर्थी गयां, परस्परनां नेत्र-कटाक्षोऽथी  
परस्परनां हुद्य वीर्धार्थी गयां.

आम लांभा समय सुधी ठाऊं रडेवाची  
श्रीराधिकाल श्रमित थयां, लावविवश पणी  
लिलिताल साथे थील निकुञ्जमां पद्मार्थी, लां  
हीन घनी, प्रियतमना ख्यानमां दीने घनी,  
लिलिताल ने प्रियाना नेत्रोमां जग्याव्या.

यतुर लिलिताल प्रियाल ने, श्यामसुद्धस-विहार  
कृता हुता, ल्यां निकुञ्जनी एक निकुञ्जमां प्रभावाची  
गयां, तद्दृन निकुञ्जी, जलर-प्रभावाची, प्रियाल ने  
प्रभुना लीला-विलासनी आंभी हरावतां, लिलिता-  
लच्यै श्रीराधिकाल्लु परना एवं विलासनु वे, ग्रान  
क्षुर्यु ते आ अष्टपदी.

प्रियाल निरपे छे अने लिलिताल गाय छे,  
व्यापके आ अष्टपदीनो वार्थ “अमे  
आव विचारीचे,

आ अष्टपदी संस्कृतमां छे, तेमां नव पृष्ठ  
(स्लेक), छे, प्रभुचे नव प्रकारना भाष्याणा।

वज्रकातो साथे अंडी लीला-विहार “क्षेची” छे,  
मुख्य धज्जाक्षतो निर्गुण्य भाष्याणां छे, तेमां  
स्वामिनी श्रीराधिकाल छे, तेचो आ विहारमां  
संभिलित नसी, आ विहार सानिष्ठ, राजस  
अने तामस-लाव-प्रधान धज्जाक्षतो साथीनो छे.

पृष्ठ : १

## हुशिंह लज्जयुक्तीशतसंगे

विलितस्ति कृतिश्चिंग्यावृत्तपारण्युपर

१८ रतिपति भान लंगे, १

## पद्मानुवाह (गुजराती)

हुरि आही प्रज्ञयुक्तीशतसंगे,

विलिते कृतिश्चिंग्यावृत्तपारण्युपर

२८ रतिपति भान लंगे, १

(वज्जलापा)

वज्जभे विहुरत न द्वलाला,

कृतिक भन-भय आहन ललवत,

संग लिये वज्जभाला,

कृतिश्चिंग्यु भज्जाक्षत हस्ती,

कृत विहार रसाला,

महलार नायन विशाला,

मनुमे विहारत न द्वलाला, (१)

वामव्यार्थ - रतिपतिभानं लंगे - रति-  
पति = धामहेय = धामहेयमुः अभिभानं नीलांरां  
घेवा क्षे श्रीराधिकाल - इह = आही = हुशिंह =  
श्रीहुरि - धज्जानुवती शतसंगे = सौकडे  
धज्जानुवतीच्योनां संगमां धरिश्चिंग्यावृत्त-  
पारण्युपर = हुशिंहच्योनां टोणाची वीटपायेत  
धज्जानुवती - इवां = नी जेम - विलितस्ति =  
विलिते कृते छे, (१).

लावार्थ : रति अने कामहेवनो महेतु मिर्देन  
उरे तेवा हे श्रीराधिकाल जे, आही = एकामने  
ललवे देवी एकांडा धज्जानुवतीच्या साथे श्रीहुशिंह  
जे विलिते देवी एकांडा करे छे, लावे कौर्म भद्रा-भूता  
धज्जानुवती हुशिंहच्योनां टोणाची वीटपायेत, भस्ता  
घनी विहार न करतो होय ! (१)

**વિવેચન :** શ્રીસ્વામિનીલુને 'રતિપતિમાનભાગ' ક્ષેત્રથી સંપોદન કર્યું. કારણ કે હે ખારીલું, તમે તમારી સુંદરતાથી રતિ અને કામદેવના મહનું ખંડન કર્યું છે, તેમ કોટિકાર્યાદ્યાદ્ય શ્રીસ્વામસુંદરના માનતું પણ તમે ખંડન કરશો. માટે અંદરે આપ આ 'ક્ષાણુના' વિદેશાથી વ્યધિત નથાન, તેમ સૂચણું છે.

ખીજું કારણ આ પણ છે; રતિને ગર્વાંછ કે મારા અને આરા પતિ જેવી હુંદુરતા તો એઠનામાં નથી. અહીં પદારેલાં સેકડો મજબાદો એને મળેશે રતિના આ ગર્વાંછ ખંડન કર્યું છે. રતિપતિ કામદેવને પણ ગર્વ હોય કે શિવજી જેવા મહાન યોગીને પણ મેં કામીવિષય કરી નીધા પ્રલુદે અહીં આઠવાં ખંડાં મજબાદોં સાથે રમણ કર્યું, પણ પોતે 'અન્યાનું' રહીને; કામદેવનો ગર્વ ચોગાળી નાંખ્યો; માટે 'રતિપતિમાનભાગ'.

અહીં શ્રીસ્વામસુંદર 'માટે' હરિ શાખા વાપર્યો હરિ એટલે હંચણું કરનાર, પ્રલુદે વિહૃણ માં સાંચિત્વાદ મજબાદો અને વિહૃણ 'નિરખતા' શ્રીરાપદાલુના મનતું હરણ કરી, પોતાનામાં જોડું છે.

'હરિ' શાખાના 'ખોળી અથ' છે હુંથી; પ્રલુદે અહીં ગજરાજ સાથે સરખાંબાં છે, માટે અંદરની અલોકિક 'ગંગાના' પ્રલુદું સૂચના 'હરિ' શાખાથી થાય છે.

પ્રલુદી હીદને હાથીની હાથીડા સાથે કેમ સરખાવી? રસશાકમા ઉત્તમ રમણ માટે હાથીનું દ્વારાંત આપવામાં આવે છે. રતિસુખનો સર્વોત્તમ આનંદ હાથી કુભાણી શકે છે અને એક સમયે અનેક હાથીઓને તે આનંદી રૂપનું કરી શકે છે. બીજા હાથીને લોં પ્રવેશ મળતો નથી. તેની દૂરીએ કેવી? સાંખ્યેપાત્રનેક કંજબક્તોને પ્રલુદ રસદાનાંકરેણીએ એનીઓ કોઈ સુરૂધનો પ્રવેશ નથી.

આમ, આ પ્રથમ પદમાં પ્રલુદના મજબાદો સાથેના સભૂલ-વિલાસનું નિરપણ થયું.

હેઠેના પ્રથેક પદમાં વિવિધ લાવવાળાં પ્રથેક મજબાદો સાથેના અલગ અલગ વિલાસનાં દર્શાન અને ગાન છે. (૧)

૫૬ : ૨

વિશ્વમ સંભમ દોલવિવેચન, સુચિત્વચિત્તસાંબન્ધ, કાપિદ્ગાંચલ મુવલયનિકરે, રંધતિ તાં કલરાવમું, પદ્ધાનુંબાદંઃ (શુભજાતી),

અમિત વિલાસે, ચાંચલ નયને, સૂચ્યવતા ખંડું ભાવ, કોઈક નેત્રકટાસ-કમળથી, પૂજે પિયુ કલરાવ, (મજલાખા)

શાસનુંલિલાસમેં દોલ-દોચનસો, પ્રકટાસ ભાવ, રેસાલા, ત્રાપ, નિયંત્રનેત્ર-કટાસ-કમલસો, પૂજાત સ્થામ તિમાલા, અંતરથે આનંદ અપારા,

સુધુનુંનુંનેં લિહરતનુંલાલો, ર

અન્યાથીઃ વિશ્વમ સંભમ = લરાથી દ્વરતાંદ્વરતાં (વિહરતા) દોલાવિલોચન = ચંચળ વિદેશે, સુચિત્ત = સુચિત્ત છે, ચંચિત્તસાંબન્ધ = મનના ખાગો, તાં = રેતો, કલરાવમું = કલરબ (સખુર-ચંચની), કાપિ = કોઈક, હગાંચલ = નેત્રકટાસો, હુંષુલયનિકરેં = કમળો વારુ, અંચિતિ = પૂજા કરે છે. (૨)

**લાવાર્થ :** પ્રિયતમા લરાથી મજબુતનીયોના શ્રુધમાં ધૂમી રદ્ધા છે, ધૂમતાં ધૂમતાં ક્ષારારેણાલાલું પ્રલુદીનું જોઈને શાસમાઈનીલાલું છે, ક્ષારારેણ મજબુતનીયોની સામે જુદ્દે છે, તેમને રસદાન કરવાના પોતાના અલભાં સંચિત્ત હરેલા ભાવેને અનુ ક્ષારારેણીનેત્રો દ્વારા અને ક્ષારારેણું દ્વારા ચંચે છે, આવા પ્રાણુનાથને કોઈક ચીંપી પોતાના

નેત્રકટાસથી નિરખી રહી છે. જણે પોતાના નયન રૂપી કમળો વડે પ્રલુદન ન કરતી હોય!

**વિવેચન :** 'કલરાવમું' પદ દ્વારા ચેણુનાંદું પણ સૂચન છે. રસદીલાંમાં વેણુનાંદ અને મધુર વચ્ચન કામદેવનાં ઉદ્ઘોષણ છે. "અમ" ધાતુ પૂજના અર્થમાં વપરાય છે. મજબાદો નેત્ર-કમળથી પ્રલુદી પૂજા કરે છે, એટલે પોતાના નેત્ર-કમળના કટાસથી, પ્રલુદે મોહિતી કરી રસવશ કરે છે. લારિત વિહૃણ, નેત્ર-કટાસ, મધુર વચ્ચનો, અને વેણુનાંદ દ્વારા રસદો ઉદ્ઘોષ-પ્રાકટય થયો છે.

આ કીડનિહાર 'સાત્ત્વિક - સાત્ત્વિક' મજબાદો સાથેનો જણ્ણાય છે. પૂજન એ સાત્ત્વિક લાક્ષોનો સ્વભાવ-ધર્મ છે, કમળ સાત્ત્વિકોમાં પણ સાત્ત્વિક છે. તેથી કમળ દ્વારા પૂજન 'સાત્ત્વિક-સાત્ત્વિક' મજબાદોનું સૂચન કરે છે, જેઓ પ્રલુદના નેત્રકટાસ દ્વારા જ રસવશ થઈ ગયાં છે. (૨)

स्विमतद्वयि उचितरताननभमेल-  
सुहीक्ष्य हेदेतिक्ष्म,  
सुंभति कापि नितंभवती  
करतलधृत चियुकमेन्हम् ३  
पद्धानुवाह : (गुजराती)  
स्विमत उचिये हस्ति सुंहर  
मुख-कमल लोहि स्वभ-क्ष्म ३  
चुंधे कोई नितंणवती,  
कर पेर अही चियुक अमंह ३  
(मजबापा)

मधुर मधुर मुसकत मोहन-मुख  
निरभत हक्क वज्जाला;  
भारी नितंभवती गाडी ढेडी,  
चुमत चुप्यक गाला,  
पिभत पेयुको वाता,  
मजमे विहरत नहलाला ३  
अन्वयार्थः हडेः हस्तिना, अतिक्ष्म=  
मुख सुंहर; स्विमत उचियुचितरतर = मधुर

स्विमतथी वधु सुंहर, आनन करतलभ् = मुख  
कमणे, हीक्ष्य=जोहने, कापि नितंभवती=  
कोई एक नितंभवती, करतल धृत = हथेणीमां  
धारणु करने, चियुकभ्=हडप्यनी, अमंहम्=  
आतुरतापूर्वक (दीर्घ समय सुधी), चुंभति =  
सुंधन करे छे. (३)

लालार्थः अलोकिक रतिरसने प्रकट करतु  
श्रीहसितरतु सुंहर वदनकमण मह स्विमतथी  
सविशेष भनेहर ज्ञाय छे. आवा अद्भुत  
मुखारविहने निरभतां कोईक सुंहर नितंणवती  
गोपिणी, संयम शुभावीने ग्रजुना श्रीमुणी  
हडप्यनी पकडीने खण्पूर्वक, उच्च स्वरे  
सिसकारा करती, दीर्घ समय सुधी ओ मुखारविहने  
दूमे छे. (अकुना अधराभृततु पान करे छे.) (३)

विशेषयनः प्रजुनु मुखारविह सहज सुंहर  
छे. पर्यु अत्यारे अलोकिक रतिरसनो आनंद मुख  
पर विलसे छे. तेथी प्रजु भुङ्क स्विमत करे छे.  
लादे आपतु मुखारविह विशेष शोभायमान  
ज्ञाय छे. ते द्वारा प्रजु गोपिणी भन हुरे छे  
माटे अही “हरि” पह छे.

जेनी कट्ठी नीथेनी जधानो पूर्ख लाग  
अति सुंहर हाय तेने “नितंणवती” कहे छे.  
“नितंभवती” पह सात्त्विके धर्मनो सूचक छे;  
ज्ञारे चुंधन राजसं धर्म छे. तेथी आ मजबकत  
सात्प्त्विक-राजस लक्ष्मा छे. (३)

उद्दलट लावविलावित चापल  
मोहन निधुवनशाली,  
समयति कामपि भीनधनस्तान  
विलुक्ति नववनभाली ४  
पद्धानुवाह : (गुजराती)  
उक्क लाव प्रकाशित चापल  
मोहन निधुवनशाली;  
समता तो भीनधनस्तान  
मुख उपाता वनभाली ४  
(गुजराती)

सुरत-सभरमे शुरः शिरोभिवि,  
मनहर मोहन लाला,  
विहरत वनजनसो लुक लुकके,  
धनः स्तनपे वनभाला,  
चंथल करे अंग रसाला,  
मजमे विहरत नहलाला.

अन्वयार्थः निधुवनशाली मोहन =  
निधुवन (निधिवन) ने शोभित करनारा मोहन,  
उद्दलट लाव विलावित = उक्क लावथी  
विलावित, चापल = अपण, समयति = रमण  
करे छे, कामपि = कोईकना, भीनधनस्तान =  
ग्रजाठ स्तनो पर, नववनभाली = नवीन  
वनभाला, विलुक्ति = विलसे छे. (जूले छे) (४)

लालार्थः निधिवनने अलंकृत करतां महान-  
मोहन अंकुमां, रसहान करवाना लावा उक्क खनतां,  
ते माटे आप अपण धन्या छे, कोईक ग्रजाठ  
स्तनोवाणीं गोपिणीं आप नभाली, निजः अंगने  
आंदेलित हरी, ते गोपिणीं पर आप झुके छे,  
लादे आपना कठमां विराजली नूतन वनभाला,  
ते गोपिणीं कठेणु, ग्रजाठ उरोज-युगल पर  
झुके छे. (४)

विशेषयनः जेम रसहान माटे ग्रजुमां लाव  
उक्क ट, अप्यां छे, मतेमरि रतिरसः आचुपा  
गोपिणीयोनाहूरुप्योन्हप्यु उत्तद लावती अस्ती  
थवायी, रेलोन, मधु समति, अपण ग्रजानी, ग्रजु  
साथे रमण उक्क छे, रसहपरना ग्रजानी, उक्क  
जरपी, रमण, इरम्पोत ग्रजुनी वनभाला  
तेमना उरोज पर फ्रेले छे, ग्रजु तुप्यु तेमना पर  
झुकी रसहान करे छे.

ग्रजुने, अलुरुत रमण, करुतु ते आलिक पर्म  
छे, ज्ञानादे लावती, उक्क द्वारा लुमे, लामस पर्ग  
छे, तेथी लावा गोपिणी, ग्रजु उप्प-ताप्पस छे, तेमना  
सुमधानार्थः मधुनु ह रमण, छे, उक्क द्वारा लुमा

ନିଜୁପତ୍ରିଃ ଶକ୍ତେତୁତୁମଲିଷୀହୁ ହାତି ସିତିଲାଯମୁ  
କାମପି ଧ୍ୟାପି ଅତ୍ୟାକରେତ୍ରେ ତୁତୁକେନ ଅଛାସମ୍ଭୁତି

પદ્ધતિવાદ : (ગુજરાતી)

ਨਿਜ ਪਦਿੰਥਾਣੁ ਕਰੇ ਸੱਤਵਰ,  
ਨਿਰਖੀ ਹੁਣੀ ਸ਼ਵਿਲਾਸ,  
ਝੋਕ ਕੋਈ ਨੇ ਅਗਧੀ  
ਆਗਜ਼ ਕਵੇ ਕੌਤੁਕੇ ਸਹਾਸ. ੫  
( ਬਜਲਾਥਾ )

નિરખત નાથ : નિકટ નિજ આવત,  
 આલિગનકે રસાલા,  
 ૪૨ દીક ઓર કાહુકો : મિયમે ;  
 ચેકરી મહનકી જાલા,  
 હંસી : વાસણાણી : વિજબાલા,  
 ઘરભે : વિહુરતી નહુલાલા. ૫

આન્વયાર્થ : સાંબિલાસમુ = કૃડા-બિલાસ  
 કરતા, હરિ = હરિને, નિજપત્રિરેખાકૃતે =  
 પોતાને આદિગન આપવા માટે, આતુરુતમુ =  
 ગડપથી આપતા, આભિવ્યક્તિય = જોઈને, કાપિ =  
 કોઈચ, ગોપીએ, ડામ્પિસમીલ, ગોપીને-  
 કરુને, કૌતુક, કરવા, માટે, ખલાત = બળપૂર્વિક,  
 અચે = આગળ, અકરોત્તુ = કરી, સહાસમુ =  
 હાસ્યપૂર્વક.

**ભાવાથે :** બીજુ એક ગોપિકા જુબે છે કે વિલાસવંશ પ્રિયતમ ચોતાને આદિગન આપવા રસમાં જૂભતા અંધ્યથી તેની સામે જીવી રહ્યા છે, ત્યારે તે હિતુછવતી ગોપિકા હુસ્તા હુસ્તા પોતાની પાસે જીવોલી બીજુ એક ગોપિકાની પ્રેરણની આગળ પ્રખૂની સામે જાલો ઝડી હો છે।

‘બિવેચન’ : પ્રથમ નકદે આ લીલા હાંસીની જણ્યા છે. પણ તેમાં ગુણિતમાર્ગનો ખૂબાં જિંદ્ગીએ લાભ રહેલો છે. આપણે સામાન્ય રીતે પ્રભુના દર્શન આપે સેવામાં ધીરજને પાછળ રાખી, પોતે આગળ જવાનો ઓથેંડ રાખીએ છીએ. આ કામભાવ છે. તે બિતરતી દ્રષ્ટાનો છે. પોતે પાછળ જરૂરી ધીરજને આગળ કરી લાભ દેવા હેવા એવો સર્વાર્થભલાલ છે. તે ઉત્તમ દ્રષ્ટાનો છે. ગુણિતમાર્ગમાં સર્વાર્થભલાલની વિશેષતા છે. આ ગોપિકા પોતે પ્રભુનું આદિગન ન ભાષુંતાં, ધીરજને લાભ કરી આપી આવો સર્વાર્થભલાલ ખાતાવે છે. આ કૌતુકથી ગોપિકા હસી, તેમ પ્રભુ પણ પ્રસન્ન થઈ હસ્યા.

આ પહેંચા બોગપિઠાઓ સાથે લીતા-વિતાસ છે. બીજા ગોપિઠાને આગળ કરી, પોતે પાંછથી હુટનાર ગોપિઠા ‘શાખસ-રાખસ’ છે. આમ કંશવાથી તે ગોપિઠાનો પોતાનો રસ અધિક પણ થયો છે.

... સાંસુપ્ર આવેદ જે ગોપિકાને અલુચે આરંધિગન  
આચ્છુ', તે ગોપિકા 'ક્રાંતસ-સાચિક' છે: 'તેમણે  
સ્વય' પોતાના સુખ માટે ભનોરથ' કહ્યો નથી. (૫)

पृष्ठ : ६  
कामपि नीविदा ध विभोक्तससंभवतिक्षेपनयनाम्  
रमते संप्रति सुमुपि धत्वादपि  
क्षेपत्वाधत्विक्षेपनयनाम् ६

પદ્માનુભાવ : (ગુજરાતી)

કોણક નીચિ-બાધ વિમોદ્યને,  
સંભ્રમ લક્ષ્મિના નથનો;  
રમતાં હુમણાં સુસુખિ ! હુઠ થડી,  
કર્યાં ધરી, તિજ વસનો.  
(વનજાપા)

नीरी-भाष्य खुडावत छलसो,  
दब्जिलत नेत्र विश्वाला,  
रमत रम्भु रम्भु संग खलसो,  
मधुरे धरे वसन रसाला,  
कर्ह रसभस थड मृगणाला,  
प्रज्ञने विहरत नंहवाला.

अन्वयाधः : कामपि = कौरुष गोपीनी  
 नीवीभूधिभोक्त्स = नीवीभूध छोड़पता  
 संभ्रमलिङ्गत नयनाभ्यु = संभ्रमयी लिङ्गत  
 नयनोपाणी सुसुभि = हे सुंदरी संभ्रति =  
 अस्तरि निर्जवसनाभ्यु = पेतानां वस्त्रोने  
 कृतद्वयृत कृष्णपेषी भक्ति = कृष्णते = कृष्ण  
 कृत उ. (६) १४८ १५०

**ભાવાર્થ :** હે સુસુપ્તિ રાધી ! તુંબો, રસ  
કીડામાં ઉંમત્ત બનેલા પ્રિયતમ પેટી વજળાળા  
નીવીખંધે છોડવા તત્ત્વર થયા છે, ત્યારે તે ચુંદર  
શું કરવું અને શું ન કરવું લેવા સંભવમથી  
નયનોમાં લંજળા આણી, પોતાનાં વસ્તોને પોતાનાં  
હસ્તથી પઢું રહ્યે છે. સરકંબાં દેતો નથી. આવી  
ગોપિકાને શ્રીરસેશ ખળપૂર્વક દમણું-રસાન કરી  
રહ્યા છે. (૧)

**બ્રિટિશેનું :** આ પ્રસંગમાં એ સિદ્ધાંત  
ખતાવ્યો કે કંપાડેલાકાં બાગબહુસંખ્યાધી ખાલાંતરમાં  
લોકદેણની લજાણ-કાનિને વશ થઈ સ કોચ અનુભાવે  
છે, લારે અગવાન બળપૂર્વક એ લકૃતાનો સથ  
સ કોચ હર કરાવી, તેને અલોકિકમાં મધ્યતા કરી  
રસદાન કરે છે.

આ ગોપાંગતા ‘રાજ્ય-તામસ’ છે. નેત્રમણજી એ રીતે ‘રાજ્ય’ ધર્મ છે અને હઠ કરવી એ ‘તામસ’ ધર્મ છે.

प्रियपरिदृंश विपुल धुलधापती द्वियुषित-सुक्षमगशरीरा,  
उद्गायति सर्व कापि सम हकिष्या रतिरथुधीरा । ७

## અધ્યાત્મવાદ : (ગુજરાતી)

પ્રિય આતિગન વિપુલ પુલક  
ધર દ્વારાખૂટ સુભાગ શરીરા,  
ગાય કોઈ સર્પી છે રિષિર સંગે  
ડૃતિ રસમય રથધીરા. (૭)  
( મજબૂતા )

पियडे भित्तनसों शयो पुवडित तन,  
विक्सत अंग रसाला,  
पिय संग गावत छयो झुक्सें,  
रुति-रस आतुर भाला  
विपट रही श्याम तमाला,  
मज्जे विकरत न हलाला  
अम-वयार्थः ॥ प्रियपस्तिं ला = प्रियपस्ति  
मालिगवायी विपुल पुलकावली = नैमानी

સમય રેમાવદી રેમાચિત થઈ છે. 'દ્વિગુણુત-  
સુભગશરીરા' = જે મનું સુદર શરીર સુપુષ્પ બાયું  
છે, રતિરખુધીરા = જે સુરત-સામ્રાજ્યમાં ધીર છે,  
કાપિ = તેવી કોઈક ગોપિ હરિણા સમ' =  
હરિની સાથે ઉદ્ગાયતિ = જીથા સ્વરે ગાન  
કરે છે. (૭)

ભાવાર્થ : - હે સપ્તી, તમે જુઓ ! સુરત-  
સંભાળમાં ધીર ઘોણી પેલી ઘણા ગના પ્રાણીશને સામે  
જઈ આદ્વિતીનાં આપડાં, આદ્વિત રૈખમાંથી થઈ છે.  
તેનું સુખગંગાશીર હર્ષથી સુષુપ્ત બની ગયું છે.  
તે રતિ-રષ્ણમાં ધીર બની, અગ્રમતી, પ્રિયતમ સાથે  
સ્વર મિલાવી ઉચ્ચ સ્વરે અધ્યક્ષ ગાન કરે છે. (૭)

विवेच्यन् ॥ उपितृसपानथी अंग अंदीकि  
भनी सुपुष्ट अने छो तेतु नोम ४. 'सतुनवल्प'  
अलुना अंग संगथी लक्तनां रोम रोम प्रकृष्टित  
थाय ॥ स्वारे कुहयने हित्य ॥ रस लीकागान इपे  
भहार प्रकटे लक्तना ॥ रसावेशथी लगवान पछ  
रसाविष्ट अने उक्तय अणान् रसपैष्टु गान करे.

‘વિધ્યરસે કરતાં બગલ્દુ-રસ વિલક્ષણ છે,  
બગલ્દુ-રસ આત્મ-બોધ્ય છે. તે સર્વ ઈન્ડીયોથી  
એક સાથે અણ્ણાય છે.

મુજુ કાપણા શિખ-રોમમા વ્યાપી થાય તે  
‘અહિરંશ’ તેનો અનુભવ ઉઠ્યુટ વિરહાનસ્થમાં  
થાય. મજુનું આ વિપરીત-મર્મી લાગુ છે. એ  
વિરહને અહે તે ચાંદુને પ્રાપે.

‘तामस-सात्त्विक’ छे. देति-  
कथाम् ‘तामस’ धर्म छे. गान ‘सात्त्विक’  
धर्म छे. (७)

## બધાતુવાદ : (ગુજરાતી)

રમતાં સંભાન્ધી સરતાં ૫૮,  
ચાંદન લિપું ૭૬૪,  
નિરખે હિમતમથ લિલિઅતી ભનથી,  
પિયુ કે વધુ સવિકાર. ૮  
(દ્વારાબાબા).

विलक्षण संभवसों, पट सरकार  
आचरण होत आपारा,  
थतुर प्रितम, पांडी याहन्यन्धित  
निरभात अंग उदारा,  
नयन हेड़ि वहृत विकाश,  
झज्जे विडरा नहिलाता.

**अन्वयार्थः** : विष्णुम् स अम् = उत्तरप्रभा, गलद् चाल = पालव सरके छे, अलयांचितः = यहनथी लेपायल, अंगसुहारम् = सुहर अंग, विस्मितमनदा = विस्मयपूर्वक, सविकारम् = विकार सहित, अस्मिताभिः = स्मितपूर्वक, अश्यति = निश्चये छे. (८)

ભાવાર્થ નાં પદનો ભાવાર્થ શ્રીમતેશ  
અને મંગળના ઉલયના વાર્થાનાં હિંટાવી શકાય.

ઉત્તાવળમાં હોઈ સુનયના ગોપિકાનો પાલખ  
વધાયેલ પરથી સરહી જતા, તેના ચેહણથી  
દોપાયેલ સુખદ, વિશાળ ઉડેલોને, શ્રીયામસુરર  
વિદ્યમધ્ય અને વિકાર સહ, આસાધિત પૂર્વક-સભિત  
નયને નિરખે છે।

जिसने : गोपिकामा दृष्टिमां विकार शाने ?  
मधु श्रेष्ठां गवाचोत्पु अभूतमा कीड़ा करी रहा थे,  
सेथी अमा गोपिका, अनवृच्छित एकांत जगी अभय  
सेथी दृष्टिमां दृष्टिमां विकार थे अने अह सुखान  
पथ उठ आहे तपु अहत गोपिका दृष्टिमां था अहे ॥

અનુભવિત શ્રીમંગના વર્ણનથી પસંત ખેલતુ  
પણ સૂચના છે. (c)

ચલતિ કયાપિ સમ સકરથક

મલસતર સવિલાસમ.

રાધે તવ પૂર્યતુ મનોરથ

શુદ્ધિતમિદ હરિસામ.

પદ્માનુભાઈ : (શુજરાતી)

કોઈ સંગ કર થહીને ચાલે,

આલસ લાખો સવિલાસ,

રાધે તવ પૂર્ણ જ મનોરથ,

પ્રગટિત આ હરિ-રાસ,

(નજરાસા)

ચતુરા કે સંગ ચલત વર-નિહૂલ,

કર થહી ગંગતિ ચાલે,

પ્રિય “ઘરદન” કે પરમ રસીદે,

વિલસત મદન ગોપાલ,

લિધે સંગ મજડી ભાલા,

મજમે વિહરત નંદલાલા.

અન્નથાર્થ : અલસતર = આણસયુક્ત,

સવિલાસમ = વિલસવથ, કયાપિ = કોઈકને,

સકરથક = હસ પકડીને, સમ = સાથે,

ચલતિ = ચાલે છે, રાધે = હે રાધે, ઈંઈ =

આ, હરિ-રાસમ = શ્રીહરિની ઈસીડીને,

ભટીત = લોઈને, તવ = તારા, મનોરથમ =

મનોરથ, પૂર્યતુ = પૂર્ણ થાયો. (૬)

લાલાર્થ : લીલા-વિહૃણથી રસવશ બનતાં

આલસયુક્ત અગવાળા પ્રાણેશ વિલસવથ, કોઈક

મજંગનાનો હુસ્ત પકડીને તેની સાથે ચાલી રહ્યા

છે. નિહૂલભાં રસદાનાર્થ પદારી રહ્યા છે. (૭)

હે રાધે ! શ્રીહરિષની આ પ્રકૃતિ રાસ-

કીડાનો હથેન કરીને, તારા મનના મનોરથો પૂર્ણ

થાયો. (૮)

વિચેચન : ‘સકર થહમ = હેઠિ’ પકડીને

હાથ પકડવો એટલે લમ કરવું. એને અર્થ છે

સંપૂર્ણ આશ્રય, આપી, તેતું કાય સિદ્ધ કરી

આપું, જેમ લાન દ્વારા લુધનલરને સંણધ

થાંધોથ, તેમ લગલાન અને લક્ષ્યનો આ સંણધ

કાળુક નથી-નિયનો છે, જન-મજનમાતરનો છે.

પ્રલુબ પોતાના નિહૂલનોતું સ્વય પાણું-થહલુ

કરીને એમને નિહૂલીલાતુ સુધે આપવા લઈ લયે

છે, એ લાલ છે.

આ અલાગના લીલા-વિહૃણથી અતિ શ્રમિત

થાન શિથિલ થયેલા પ્રલુબા પરિથમનો વિચાર ન

કરતાં, તેમનો શ્રીહરિસ્ત પકડી, સર્વાની વચ્ચેથી

તેમને આલગ નિહૂલભાં પ્રપરલી જાય છે. માટે

આ લક્ષ્ય ‘તામસ-તામસ’ છે.

આમ શ્રીલલિતાલુણે શ્રીરાધાલુને શ્રીરોશના  
લીલા-વિલાસના હર્ષન કરાલી, તેનું ગાન કર્યું  
શ્રીરોશના આ લીલા-વિલાસને નિર્ણયી વિભયોગના  
અનિશ્ચી પીડિત શ્રીરાધાલુને લલિતાલુણે લિનતિ  
કરે છે: તમારી સંમતિથી જ પ્રલુબ સર્વ મજંગના-  
ગોને સ્વરૂપાનંદનો અતુલબ કરાવે છે, તેમના  
મનોરથ પૂર્ણ કરે છે, તે સર્વ સથુણ બાંકતો છે.  
જ્યારે આપ તો પ્રિયતમના પ્રાણેશરી છો, નિર્ણય  
છો, આપને આત્મારે વિભયોગ થાયા કરે છે, પરંતુ  
પ્રિયતમ શ્રીશામસુંદર આપની પાસે પેઢારી,  
આપના સર્વ મનોરથો અવરથ પૂર્ણ કરેશો. (૯).



# હરિરિદ મજાયુવતી શાતસ્તો

શાગ-વસ્તંત

હરિરિદ મજા યુવતી સતસ્તો  
વિલસતિ કરિણીએયુવતવાશ્યુબર ઈવિ વતિપતિમાનભંગે ॥ ૧૩ ॥  
વિભામ જંભામ બોલ વિલોચન સૂચિત જંચિત લાખમુ  
કાપિ દગાથલ કુલલય નિકોરાચતિ તં કલરાખમુ ॥ ૧૪ ॥  
સિમત રચિ રચિરતરાનન કભલમુદીક્ષ્ય હુરે રતિકન્દમુ  
ચુશ્યાતિ કાપિ નિતઅંબતી કરતલપુત ચિયુભામનનમુ ॥ ૧૫ ॥  
છૂલટલાવ વિલાવિત ચાપણ ગોડેન નિધુષન શાલી  
રમયતિ કામપિ ચીનદનરતન વિલુલિત નવ બનમાલી ॥ ૧૬ ॥  
નિષ્પરિભલ કુતેલુ કુતમચિલીક્ષ્ય હરિ અવિલાસમુ  
કામપિ કાપિ ખલાદકોલે, કુતુકેન સહાસમુ ॥ ૧૭ ॥  
કામપિ નીલીથન વિલોક્ષ જંભામ લજલુત નયનામ  
રમયતિ સર્વપ્રતિ સુભુષિ ખલાદપિ કરતલપુત નિબલસનામુ ॥ ૧૮ ॥  
પિષ્પરિભલ વિપુલ પુલકાખલિ દ્વિશુષિત સુલગ શરીરા  
છૂલગાયતિ સંપિ કાપિ જમ હરિણુ રતિરણધીરા ॥ ૧૯ ॥  
વિભામ જાભામ ગલાંથલ ભલયાચિત મંગસુદારમુ  
ચશ્યતિ સિમતમધપિ વિસ્તિમતમનસા સુદ્ધાઃ અવિકારમુ ॥ ૨૦ ॥  
ચલતિ કાયપિ જમ સંકરથૃ ભલસતર અવિલાસમુ  
શાધી તથ પૂર્યતુ જોનારથ સુહિતમિં હરિયાસમુ ॥ ૨૧ ॥

શૈલ્ઘ્રાર વર્ષ-૧૨ : ઓગસ્ટ-'૯૪ : ૧૭

પૂર્વી જીજીકા :- ઉપરોક્ત આષટપી નવધનરીયા-  
મતાલ, શુગારકલપુતુમ સમા શ્રી વિલુલનાથલ ( શ્રી-  
શુભ્રાંહલ ) રચિત છે. આપણા પુણિમાળીંય ખધા મંહિ-  
રેણાં તેમજ શ્રી ઠાકેરલુની સેવા કરનાર વૈષ્ણવોના.  
ભરમાં મંગલાના હથીન યુલતી વખતે ‘મંગલમુ મંગ-  
લમુ મજલ્લુમિ મંગલમુ’ કી ઝીર્ણન નિય ગવાય છે..  
તેવીજ દીતે ઉપરોક્ત આષટપી વસંતપંચમીથી દાગણા  
સુહી અર્થાતુ કંબળોકાદશીના આગદા દિવશ સુધી નિય.  
શજદોગના વસંતસેલ શરૂ થતાજ ગવાય છે. ઉપરોક્ત  
આષટપીને લાલ ધર્મોજ ગણેદો, રહસ્યમય તેમજ રસીધા-  
શ્રી કુણ્ણની રસદ્ય લીલાનું આખગાહને કરનારા લગવદુ  
લાક્ષ્મી માટે હૃદયમાં ઉતારવા જેવી છે. ધણુ વર્ષ પહેલાં  
વિશ્વાલી સુધાના માસીકમાં કોઈ લગબહીયે તેનો શુજરાતી  
અતુલાદ છપાવેલો છે છતાં હાલમાં વસંતરૂપુ ડાવાથી.  
અને લેમના ધરેસાર્યા પુણિ પ્રણાલિકા અતુસાર થતું ઉચિત.  
શ્રીની રદેલ થતી ડોય તેવાઓને ઉપરોક્ત ઝીર્ણનોઃ  
લાગ ધર્મો જ લાભહાયી થશે. વસંતના ગેલના  
સંમચી શ્રી રધિકાલુણો માન કર્યું છે, શ્રી ઠાકેરલ-  
અનેક લકૃતો સાથે વસંત ગોલી રહ્યા છે. વસંત નામ:

શ્રીગના ખેલ પરકીય લાવસ 'પજ મજલિનાંગો માટે પરમ.  
કુલદ્વાપું છે કારણું ક્રી કોઈના દેખતાં નિઃશ્વાસિતાથી તેમ.  
જ પણ આનંદપૂર્વક પોતાના પ્રાણુષદ્વાસ મજશાજ જાણે  
જોણી શાકાય છે 'ગાને તેથીજ એટસખાંગો ગાય છે કે  
'સંજ કુલદ્વાપું હું હું' પોતાના પ્રાણુષને આવી રીતે

ચાતુરાગલાંબી બજલાકતો જાણે ખેલતાં લેઈ સહલસિદ્ધિ  
સંપાદિકે, સહલલાનિપુણ તહાપિ બોરી જોવા શ્રી રાધિ.  
કાળ માન કરે છે તે કોઈ શ્રી શુરોઈલ ચંદ્રાવલી  
સવરૂપે અર્થાત્ સહયરી રખરૂપે શ્રી રાધિકાલુને માન  
ઓડવા વિનંતિ કરે છે.

**દીકા ( મજલાખામાં ) :-** સહયરી કહે છે; હે રતિ-  
પુતિમાનભાગો નામ કામદેવકે માનણો બંજન કરવેલારી  
કે શ્રી રાધિ, દૈખ, યા સમય હરિ ને સખકે હુંમાં હતો  
શ્રી કૃષ્ણ, જે હુઅહારે મન હર્તા લર્તા હે ચો, જેસે  
હુસ્તીનીકે સંગમી ગજરાજ વિહાર કરે હે હે તેસે વિહાર  
નામ કિદા કરે હે. યહાં કોઈ શાકા કરે જે પ્રભુનુંકે  
વિહારમે હુસ્તીનીકે વિહારએ દંદાંત કેસે ? તાકો સમા-  
ધાન હે હે જે હુસ્તીનીકે શુંગમે જોકહી હુસ્તી વિહાર  
કરે હે, ઝેર જા વનમેં વિહાર કરે હે હે, તહાં હુસરો  
હુસ્તી ન આથ શકે. કહાપિ આય જાય તો વિહાર હર્તા  
એક યશોદેસંગલાલિત શ્રી કૃષ્ણાહી કે, તાતે ગજરાજને  
શમણુંકે દંદાંત હે-અણ આગે પદમે વિહાર વણુંન કરે હે.

**વિજાગ ધર્તિ-ગોપાંગનાકે શુથમેં કોઈ જોગી અપને**  
નેત્ર કટાશ હૃપુ કમલન કરુંકે શ્રી કૃષ્ણાહી પૂજન કરે હે.  
તા સમય પણુ કેસે વીચાયમાન હે જે ગોપાંગનાકે શુથમેં  
વિહારસંભમતો ચંચલનેત્રન કરુંકે ચંચિતસાવડી જ્ઞાનના,  
કરે હે જોર મધુર શળહ યોદે હે તાકે રસકો હુદ્રાણાધ  
કરે હે. યામેં સાત્થિક સાત્થિક લાક્તા હે શુથમેં વિહાર વણુંન કરે હે-

**કિભતસ્વચ્છિ ધર્તિ :-** કોઈ જોપાંગના નિતાભવતી,  
નામ એવીકે પીછેકો લાગ સુંહર હે જાકો, જો જોપાંગના  
શ્રી કૃષ્ણાહી અંધકારયસુદૂરત અતિસુંહર આનંદકાંહ સુખકમલ  
દેખુંકે આપને કરતે અટિત પ્રભુનાંકી વીજુંક ઘરકે ચુંખન  
કરે હે. યામેં લાંબ-જોસે ભરમર કમલપર એકુંક રસપાન  
કરે હે તેસે અંધરાચૂત સુખકમલાહી રસપાન કરે હે હે તાતે  
સાત્થિક રાજસ માર હારે. રતિનો આનંદ એક હુસ્તીકોણી  
હે તાતે રસશાખાંગો દંદાંત હુસ્તીકો હેકે. જો રસશા-  
ખોક્કા લાક્તા હે. આગે પદમે સાત્થિક તામસ લાક્તાકે  
શુથમેં વિહાર હે.

**ઉત્કષેપશાલ ઈતિ :-** ઉત્કષેપ કામલાવ કરે છોટ બોાર લાકૃતનાં મનહસ્ય નો શ્રી કૃષ્ણ સો નિધુબનાં વિષે શોલાયમાન હોયકે કોઈ ગલંગનાં કે સંગ રમણ કરે તે તાંકે પીળઘનસ્તનાં ઉપર મજારાજ કી પનમાણ વિદુતિત હોય હે, યહ લાકૃત સાત્ત્વિક તામસ હેં કાંઈંતે જો રસદી પરાક્રમા-રમણુંકે વિશે પ્રભુનાં નિમગ્ન કર લીધે હેં, આપ આગે ચથુંને-

**ભિષ્પરિદ્ધિંલા ઈતિ :-** શ્રીકૃષ્ણ કોઈ ગલંગનાં આદિંગનાં કીયે હોએ પથારે હેં તખ સો મજાંગના વિદ્યાસસંશુદ્ધત શ્રી મજારાંદીઓ અપને સન્સુખ આદિંગનાં કીયે આવતે દેખકે હુસરી ગોપાંગના ખલાત્કાર આગે

કરે આપ પીછે છીયે હેં, ચા મજાર કીનું દેખકે શ્રી મજારાજ હાસ્યશુદ્ધત હીયે હેં, યાચે' રાજસ રાજસ લાકૃતનાં અપને સન્સુખ પ્રભુનાં આવતે દેખકે' રાજસ સાત્ત્વિક લાકૃતકે આગે કર હીયે હેં, અખ આગે પદમે' રાજસ-તામસ લાકૃતકે શુદ્ધમે' વિહાર વણુંન હેં-

**કામધિનીલી ઈતિ :-** સણી સહચરી જો હેં જો શ્રી સ્વામીનીલુણો કહે હેં! હેં સુનુંબિ રાયે! શ્રી મજારાજ કોઈ ગોપાંગનાં નીલી વિમોયન કરે હેં તખ યો ગોપાંગના સંશ્રમતો' લજણુંત હોયકે તા સમય પલ કરીને અપને વસન પડરે હેં-યા પ્રકાર પ્રભુ રમણ કરે હેં, યાચે' પ્રભુ નીલી વિમોયન કરે હેં જો તો રાજસલાલ હેં બોાર વસન પડ રાખનો સો તામસલાવ હેં' આપ આગેકે પદમે' તામસ સાત્ત્વિક લાકૃતકે શુદ્ધમે' વિહાર વણુંન હેં.

**ભિષ્પરિદ્ધિંલા ઈતિ :-** હેં સણી, કોઈ ગોપાંગના દત્તિસ'થામણે' જો ધીર હેં સો આપને પ્રિય મજારાજનાં આદિંગન કરે કે રામાય હોયકે દ્રિગુણિત નામ હુની સુલગા શુદ્ધ શરીરકી હીયકે પ્રભુનાં જાગ ઉચ્ચ સૂરતો' ગાન કરે હેં, યાચે' દત્તિસ'થામ ધીરપનો હેં' સો તામસલાવ હેં તાંગે' ગાન જો હેં સો સાત્ત્વિક ભાવ હેં, અખ આગે પદમે' તામસ રાજસ લાકૃત કે શુદ્ધમે' વિહાર વણુંન હેં.

**વિજાભ જીંભામ ઈતિ :-** કોઈ ગલંગના હંજીં જો અતિ વિદ્યમધ મન હીય કે આપને સુંદર નેત્રકટાસ કરે કે શ્રી મજારાજના હેઠે હેં; જ વિહારહે સંશ્રમતો' ઉપરનાં આંદ્રાન. નામ છેડા વીચેં જયકે, બોાર થંડન કરે ક્રી-અ'ગુ અર્થિત હે આર લાકૃતનાં મનોાથ પૂરણુ કરવેચેં ઉત્તાર હેં બોાર કામ વિહાર લરે મંહ સુસ્કયાન કરે હેં જોસે શ્રી કૃષ્ણનો લાકૃત હેઠે હેં' યાચે' લાવપ્રભુતકોં હુસરે લાકૃતનાં રાજસ સાત્ત્વિક લાકૃત બોાર રાજસ રાજસ લાકૃતકે જીંભમે' વિહાર હેં.

ભોગથ્ય પૂરણું કરતે દેખકે ધર્માવાચતેં આપ જાયકે  
આવિણનાંદી નહિં કરે શો તામસ લાખ હે જોર અપને  
સુંદર નેત્ર કરકે પ્રલુનકો નીદળે હે સો રાજસ લાવડીં;  
આગ આગો પહેસે તામસ તામસ લટકતે સુધ્યમે વિહાર  
કર્ણનું કરકે આટપદી સમામ કરે હે

અત્તિ હૃતાજી ઈતિ :- કોઈ ગોપાંગતાકે કર સહી  
શ્રી કૃષ્ણ થલે હે' તા સમે' પણ તેસે સોલાયમાન હોય  
હે' ને બાબસ ક્ષમાયુક્ત હૃતાજી લક્તાજનકે હૃત પહુંદે  
પથાડે હે' ( જમન ' મધુર ' નો ભાવ ) આપવિલાસ રસ-  
ભરે હે' તાતે' લક્તાજનકો રસદાન હરે હે' યામે' ભાવ-  
અલિસલરે પ્રભુનકો બાન્ધન લક્તાજી વિહાર છાડાયકે  
કોણ ઓચ વળંગના અપને સાંચ પખરાય કે ભયહે  
અથીત બાન્ધજ નિહુંબથે' પખરાવે હે' તાતે' તામથ  
તામસ ભાવ હે' યા પ્રકાર પ્રભુનકો વિહાર વણુંને કરેકે  
સફનરી જ્ઞાપી શ્રી સ્વામિનાનાંકો' કહે હે' નો હે' શ્રી રાધી,  
તુઝારે શ્રી' કૃષ્ણાહે' યહે રાસવિલાસ ને હે' સો સખ  
લક્તાજી અનોરથ પૂરણ હરે હે' ઓચ તુઝારો અનોરથ  
તો ક્ષમા સર્વંદ પૂરણ હીથ હેઠ. ઈતિ ભાવ અથીત  
તુઝારે મનોરથ પૂર્ણ' હોય.

۱۷۳

